

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ખાતે લીગલ કન્સલટન્ટની જગ્યા ભરવા  
બાબતની જાહેરાત અને અન્ય જરૂરી સુચનાઓ

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર ખાતે કોર્ટ કેસોને લગતી કાયદાકીય કામગીરી તેમજ માર્ગદર્શન માટે લીગલ કન્સલટન્ટની - ૧ જગ્યા કરા રના ધોરણે માસિક રૂ.૩૦,૦૦૦/- ના ફીક્સ પગારથી ૧૧ માસ માટે ભરવા નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઇનના માધ્યમથી આ જાહેરાત પ્રસિધ્ધ થયા થી તારીખ ૨૮/૦૯/૨૦૨૨થી તારીખ ૦૭/૧૦/૨૦૨૨ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

**શૈક્ષણિક અને અન્ય લાયકાત :**

૧. માન્ય યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાના કાયદાના સ્નાતક (સ્પેશિયલ) અથવા H.S.C. પછી કાયદાનો પાંચ વર્ષનો કોર્સની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
૨. શૈક્ષણિક લાયકાત મેળવ્યા પછી એડવોકેટ તરીકે ત્રણ વર્ષનો અથવા સરકારી વકીલ તરીકે હાઇકોર્ટમાં પ્રેક્ટીસનો ત્રણ વર્ષનો અનુભવ અથવા સ્થાનિક સ્વાયત્ત સંસ્થા/બોર્ડ કોર્પોરેશનમાં લીગલ અધિકારી તરીકે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
૩. કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
૪. ગુજરાતી, હિંદી તથા અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

**❖ વયમર્યાદા :**

જાહેરાતની તારીખે ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. (અનામત વર્ગો, મહિલાઓ તથા શારીરિક રીતે અશક્તતા ધરાવતા તથા માજી સૈનિકો માટે ઉપલી વયમર્યાદામાં સરકારશ્રીના નિયમો અનુસાર છુટ મળવાપાત્ર રહેશે.)

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા: ૦૭/૧૦/૨૦૨૨ સમય ૦૬:૧૦ સુધી રહેશે.

અરજી ફોર્મ અને વધુ વિગત વેબસાઇટ [www.eklavya-education.gujarat.gov.in](http://www.eklavya-education.gujarat.gov.in) પરથી મેળવવાની રહેશે.

**કરાર આધારીત નિમણૂકની અન્ય સુચનાઓ વિગતે નીચે મુજબ છે.**

- આ તદ્દન હંગામી અને કરાર આધારીત નિમણૂક છે ઉમેદવારોને કાયમી અંગેના કોઇ લાભ મળવાપાત્ર થશે નહિ.
- કરારની મુદત ૧૧ માસની રહેશે.
- વ્યવસ્થાપનને જરૂર જણાયે કોઇ પણ તબક્કે ભરતીની પ્રક્રિયા મોકુફ રાખી શકશે.
- કરારના સમયગાળા દરમિયાન રૂ. ૩૦,૦૦૦/- નો માસિક ફીક્સ પગાર મળશે. તેઓની નિમણૂક કરારના ધોરણે ગણવામાં આવશે તથા કરારની મુદત ૧૧ માસની રહેશે

- ઉભય પક્ષે એક માસની નોટીસ અથવા એક માસના ફીક્સ પગારની રકમ સાથેનો નોટિસ પગાર આપીને કરારનો અંત લાવી શકાશે.
- નિયત ફીક્સ પગાર પર કોઇપણ જાતના
- ભથ્થા મળવાપાત્ર થશે નહીં ફીક્સ પગાર વેતનના કોઇપણ પ્રકારનો વધારો કે ઇજાફો મળવાપાત્ર થશે નહીં મોઘવારી ભથ્થુ ,વચગાળાની રાહત અથવા પગારપંચના બીજા લાભો કે સેવા વિષયક અન્ય કોઇ લાભો મળવાપાત્ર થશે નહીં.
- સમાન સંવર્ગના અધિકારીએ જે ફરજો બજાવવાની થતી હોય તેવી ફરજો બજાવવાની રહેશે તે માટે કચેરીમાં ફરજ પાલનનું જે સમય નિયત કરેલ હોય તે પ્રમાણે કચેરીમાં હાજરી આપવાની રહેશે. તેમજ પ્રાઇવેટ પ્રેક્ટિસ કે અન્યત્ર પાર્ટ ટાઇમ નોકરી કરી શકાશે નહીં. જાહેર રજાના દિવસોએ પણ સરકારી કામગીરીની જરૂરીયાતને અનુલક્ષીને ફરજ બજાવવામાં આવે તો તે મુજબ ફરજ બજાવવાની રહેશે. રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઇ શકાશે નહીં.
- કરારના સમય દરમ્યાન વાર્ષિક ધોરણે ૧૧ પરચુરણ રજા મળવાપાત્ર થશે.અન્ય કોઇ રજા મળવાપાત્ર થશે નહીં તે સિવાયની રજા ભોગવશે તો તે રજાના દિવસના પગારની કપાત કરી લેવામાં આવશે.મહિલા કર્મચારીઓને રજાના નિયમો મુજબ પ્રસુતિ રજાઓ મળવાપાત્ર થશે
- કાર્યમથક પર રહેઠાણે રહેવાનું ફરજિયાત રહેશે અને અધિકૃત અધિકારીની પરવાગની વગર મુખ્ય મથક છોડી શકાશે નહીં.
- કરારના સમયગાળા દરમ્યાનની અસંતોષકારક કામગીરી કે અવશિષ્ટ બદલ કોઇપણ જાતની નોટિસ આપ્યા સિવાય કોઇપણ સમયે નોકરી સમાપ્ત કરવામાં આવશે.
- સરકારશ્રી તરફથી વહિવટી હિતમાં બીજી કોઇ જરૂરી શરતો નક્કી થાય તે પણ બંધનકર્તા રહેશે.
- વ્યવસાય વેરાની કપાત નિયમાનુસાર ફીક્સપગારમાંથી કરી લેવાની રહેશે.
- નિમણુંકના સમય દરમ્યાન તેમણે બજાવેલ સરકારી સેવા બાબત અંગે કોઇપણ પ્રકારની ફોજદારી કે દિવાની કાર્યવાહી સબબ રાજ્ય સરકારની કોઇ જવાબદારી રહેશે નહીં.
- કરાર આધારીત ઉચ્ચક વેતનથી નિમણુંક પામેલ વ્યક્તિને સરકારી મહેકમ ઉપર સમાવિષ્ટ થવા માટેનો કોઇ હક પ્રાપ્ત થશે નહીં.
- ઉપરોક્ત શરતો નિમણુંક પામનાર વ્યક્તિને સ્વિકાર્ય છે, તે અંગેનું સંમતીપત્ર આપવાનું રહેશે.
- આ ભરતી જે તે સંવર્ગના ભરતી નિયમો અનુસાર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોથી ભરતીની નિયત કરાયેલ પ્રક્રિયાને અનુસરીને જ કરવાની રહેશે. અને નિયત અરજીપત્રકમાં આ શરતોનો સમાવેશ કરવાનો રહેશે.
- આ કરાર આધારીત ફરજ ઉપર જો ડાતા પહેલા શારીરિક યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ(અસલ અને પ્રમાણિત નકલ) સોસાયટી દ્વારા માંગવામાં આવે ત્યારે જે તે સ્થળે અને સમયે સ્વ-ખર્ચે રૂબરૂમાં રજુ કરવાના રહેશે. અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે.
- આ જાહેરાત કોઇપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની કે જગ્યાઓની સંખ્યામાં વધ ઘટ કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સોસાયટીને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને આ માટે

કારણો આપવા બંધાયેલ રહેશે નહિ. તેમજ તેવા સંજોગોમાં ભરેલ અરજી અને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે નહિ.

- સોસાયટીને કોઇપણ અથવા બધા જ ઉમેદવારની અરજી રદ કરવાનો અધિકાર કોઇપણ જાતના કારણ આપ્યા વગરનો રહેશે.
- અરજી કરતાં પહેલા વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ ઉમેદવાર માટેની સુચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતિ છે અને ત્યારબાદ જ અરજી કરવી.
- અરજી માત્ર ઓનલાઇન જ કરવાની રહેશે રજી .એડી/ ટપાલ / રૂબરૂ કે ઇમેલથી કરેલ અરજી માન્ય ગણાશે નહીં.
- ઉમેદવારે અરજીપત્રકમાં બતાવેલ કોઇપણ વિગત અને ઉમેદવારે નિમણૂક સત્તા અધિકારી સમક્ષ રજી કરેલ શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરેને લગતા પ્રમાણપત્રો અથવા વિગતો ભવિષ્યમાં જે તે તબક્કે નિમણૂક અધિકારી દ્વારા ખોટા માલુમ પડશે તો તેની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે આવા ઉમેદવારોની ઉમેદવારી નિમણૂક સત્તા અધિકારીના પરામર્શમાં રદ કરવામાં તેમજ ઉમેદવારને ગેરલાયક ઠરાવવામાં આવશે